



**Date: August 31, 2024** 

To,
BSE Limited
Corporate Relations Department
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai – 400001

National Stock Exchange of India Limited Exchange Plaza, Bandra Kurla Complex, Bandra (East), Mumbai – 400051

BSE Scrip Code: 543528 NSE Symbol: VENUSPIPES

Subject: Submission of Newspaper Advertisement regarding the Notice of 10<sup>th</sup> Annual General Meeting, Information on Remote E-Voting and other information.

Reference: ISIN - INE0JA001018

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of News Paper Advertisements published in Financial Express (English), All India Edition and Kutch Uday (Gujrati) today i.e. August 31, 2024 which includes the following information:

- 1. Intimation of the 10<sup>th</sup> Annual General Meeting (AGM) of our Company to be held on Wednesday, September 25, 2024 at 04:00 p.m. (IST) through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM).
- 2. Completion of email dissemination on Friday, August 30, 2024 of the Notice of 10<sup>th</sup> AGM and the Annual Report for the Financial Year 2023-24 to the members whose email IDs are registered with the Company/ Depositories.
- 3. Details of remote e-voting facility provided to the Shareholders of the Company, to enable them to cast their votes on the resolutions proposed to be passed at the AGM.

This will also be hosted on the Company's website, at www.venuspipes.com

This is for your information and records.

Thanking you,

For Venus Pipes & Tubes Limited

CS Pavan Kumar Jain Company Secretary and Compliance Officer Membership No. A66752



## મોશાળા ગામના પુલનો પ્રશ્ન હલ કરવા વહીવટી તંત્ર પાસે રજૂઆત જૈનોના મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો તા. ૩૧થી પ્રારંભ થયો છે. તપ ગચ્છ જૈન સંઘ, શ્રી અચલગચ્છ જૈન સંઘ, શ્રી ખરતરગચ્છ જૈન સંઘ. શ્રી આરાધના ભવન જૈન સંઘ, શ્રી આઠ કોટી નાની પક્ષ જૈન સંઘોમાં પર્યષણ મહાપર્વ તા. ૩૧ થી જયારે શ્રી આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ, શ્રી છ કોટી જૈન સંઘ તથા તેરાપુંથ જૈન સંઘ્માં પર્યૂષ્ણ પર્વ તા ૧ થી શરૂ થશે. વહેલી સવારથી જૈન જિનાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળશ .ભક્તામરસ્રોત, રત્નાકર પચ્ચીસી, જૈન સ્તવનો, પૂજા-પાઠ, તથા ધાર્મિક વિધિઓ સાથે જુતૈયાઠ, (પાંચા પાત્રકાયા પાંચા સાથ જિનાલયો, ઉપાશ્રયો "જિન શાસન દેવકી જય" નાં નાદથી ગુંજી ઉઠશે. દરરોજ સવારે વ્યાખ્યાનો યોજાયા છે. જયારે સાંજે પ્રતિક્રમણ તથા રાત્રે ભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ પ્રભુજીઓની ની્ત નવી અંગરચના કરવામાં આવશે. પર્વ ઉજવણીનો ૄ જૈન સમાજમાં અનેરો આનંદ છે તેવું ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મીતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું. ભુજમાં મુખ્ય ઉજવણી ૫.પુ. પં.પ્ર. જગતશેખરવિજયમ. આદિ ઠાણા-૧૪ તથા સા. નિર્મળવર્ધનાશ્રીજી મ.સા. આદિઠાણા-૧૫ ની શુભ નિશ્રામાં શ્વેતામ્બર

મુર્તિપુજક-તપગચ્છ સુંઘ દ્વારા પર્વની શાનદાર ઉજુવણી કરવામાં આવશે. પર્યુષણના આઠે દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અહીં યોજાયા છે તેવું કીર્તાભાઈ શાહે જણાવ્યું હતું. ૧૦૦ ચોસઠ પોળીપોષધ તથા ૧૮૦ આંયબીલ આરાધકો, રેગ્યુલર ૧૦૮ આંયબીલ તથા ૯૫ બાળકો બ્યાસણાની આરાધનામાં જોડાયા છે

ગઢશીશા : કચ્છભરમાં

પર્વોની

ભારે વરસાદ અને વાવાઝોડા

જેવી વિક્ટ પરિસ્થિતિમાં

આસ્થાભેર ઉજવણી થવાની

સાથે આજથી જૈન ધર્મના જપ-

તપ અને આરાધનાનું અનેરૂ

મહત્ત્વ ધરાવતા ચાતુર્માસમાં

પર્વાધિરાજ પર્યુષણ પર્વની

ઉજવણીનો પ્રારંભ કરાયો છે

જે ઉજવણીમાં ભારે વરસાદની

વિક્ટ પરિસ્થિતિનો સામનો

કરી મુંબઈ-દેશ-વિદેશ વસતા

જૈન પરિવારો માદરે વતન

પહોંચ્યા છે જેઓની જેનધર્મ

પ્રત્યેની અનન્ય ભક્તિ-

વિશ્વાસ અને ધર્મપ્રત્યેની શ્રદ્ધા

અને જાગૃતતાનું પ્રમાણ પુરું

ગઢશીશા

જન્માષ્ટમીના

જિનાલયો-ઉપાશ્રયો 'જિન શાસન દેવકી જય''ના નાદોથી ગુંજી ઉઠશે

શેઠ વર્ધમાન આણંદજીની પેઢી આરાધના ભવન જૈન સંઘ દ્વારા ૫.પૂ. મુનિરાજ શ્રી તીર્થતિલક વિજયજી મે.સા. આદિઠાણા-૫ તથા ૫.પૂ. વિશ્વદર્શનાશ્રીજી મે.સા. પ.પૂ. વિશ્વદર્શનાશ્રીજી મ.સા. આદિ ઠાણા ૧૧ ની શુભ નિશ્રામાં પર્યુષણ પર્વ ઉજવાશે. ૭૨ દિવસનો જિનદીક્ષા તપ તેમજ ૧૦૮ બાળકો ૭૨ દિવસના બ્યાસણા કરી રહ્યા છે તેવું સંઘ પ્રમુખ કમલ નયન મહેતાએ જણાવ્યું હતું. વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન વિશા શ્રીમાળી સમાજ દ્વારા પર્વ નિમિત્તે વિવિધ તપ આરાધના થશે તેવું પ્રમુખ કિર્તીભાઇ સંઘવીએ જણાવ્યું હતું. વાગડ સાત ચોવીસી સમાજ અને માકપટ જૈન સમાજ દ્વારા પણ પર્યુષણમાં વિવિધ તપ આરાધનાઓ થશે.

મૂર્તિપૂજક અચલગચ્છ જૈન સંઘમાં સાં. કેવલ્યગુણાશ્રીજી મ.સા. આદિઠાણા-૩તથા હોસ્પિટલ રોડ મધ્યે ૫.પુ.સા. કિર્તીલત્તાશ્રીજી મ.સા. ાકતાલત્તાશ્રાજી મે.સા. આદિઠાણા-૨ ની શુભપાવન નિશ્રામાં મહાપર્વ ઉમંગભેર ઉજવાશે. દરરોજ विविध धार्मिक કાર્યક્રમો યોજાયા છે. પ્રભુજીની નિત નવી અંગરચના કરવામાં આવશે તેવું સંઘ પ્રમુખ મહેન્દ્રભાઈ દામજી શાહે જણાવ્યું હતું. ભુજ ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા શ્રી જીનદતસૂરીશ્વરજી ગુરૂમંદિર જૈન દાદાવાડી મધ્યે પર્વની ઉજવણી કરવામાં આવશે. દાદાવાડી મધ્યેજુદા-જુદા કલાકારો અને મંડળો રાત્રિ ભાવનામાં ૨મઝટ બોલાવશે. જિનાલયમાં રોશની સાથે પ્રભુજીની આંગી રચના થશે. વર્ધમાનનગર

દાદાવાડીતથા વાણિયાવાડ ડેલામાં

ગઢશીશા પંચકના જિનાલયો ઉપાશ્રયોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ

ગઢશીશા આદિનાથ

ગોડીજી

છત્રછાયા

સણોસરા.

જોઈએ છે

लानुलवन सभाषवाडी

भारतकार-गांधीधाभ

મંદિર માટે પુજારી જોઈએ છે. મળવાનો સમય : સાંજે ૭.૦૦ કલાકે

Mo.81606 54063

ઃઃ ગાંધીધામ નગરપાલિકા ઃઃ ओन साઈन टेन्डरनी निવिधा

રાપરીયા હનુમાન મંદિર પાસેનાં સાર્વજનિક

વિસ્તારમાં ભારતનગર રેન બસેરા ની કામગીરી भारेनो रेन्डर https://tender.nprocure.com

ओन लाઈन टेन्डर लरपानी अंतिभ ता.

૦૯/૦૯/૨૦૨૪ અને ફીઝીકલ ડોક્યુમેન્ટ

રજી.એ.ડી.પોસ્ટ થી રજુ કરવાની અંતિમ તા.

૧૨/૦૯/૨૦૨૪ ના સાંજના ૪-૦૦ કલાક

રાખવામાં આવેલ છે. જેની લાગતા વળગતા

ભચાઉ નગરપાલિકા જિલ્લા-કચ્છ

જાહેર નિવિદા - 2024/25

પાસેથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP-૮૮

૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ ગ્રાન્ટમાંથી ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં

આવે છે. આ કામના ટેન્ડર <u>http://www.nprocure.com</u> ઉપર

જોવા મળશે. અને ટેન્ડર વેબસાઈટ પર ઓ<mark>નલાઈન ભરવાના</mark> રહેશે.

ભચાઉ નગરપાલિકા જી. કચ્છ-ભુજ (ફોન નં.02837 224028) દ્વારા ઓન<mark>લાઈન ટેન્ડર માન્ય શ્રેણીની યાદીમાં</mark> નોંધાયેલ ઈજારદારશ્રીઓ

મુખ્ય અધિકારી

ગાંધીધામ નગરપાલિકા

તાા.30/08/2024 થી 11/09/2024ન

ઉપર ઓનલાઈન પબ્લીશ કરવામાં આવેલ છે.

કાન્ટાક્ટરશ્રાઆન જાણ થાય.

ટેન્ડર રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં.

ઓનલાઈન ટેન્ડર ડાઉનલોડ કરવાની

भान.धारासल्यश्रीनी ग्रांट हेठण श्री

જિનાલય, દેવપુર (ગઢ)

(રોહા), નરેડી, મોથાળા,

મકડા, કોટડી મહાદેવપુરી,

પંથકના નાગ્રેચા સાંભરાઈ, ભોજાય,

તેમજ

પાર્શ્વનાથદાદાની

કોટડા

રાયધણજર.

શાંતિનાથ જિનાલયે આવેલ પણ રોશની થશે તેવું સંઘ પ્રમુખ રજનીભાઈ પટવાએ જણાવ્યું હતું. શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી શ્રા આઠ કાટા માટા પક્ષ સ્થાનકવાસા જૈન સંઘ દ્વારા પ.પુ. સદગુશાશ્રીજ મ.સ. આદિદાશા-ર ની નિશ્રામાં પર્વ ઉજવાશે. આઠે દિવસ જુદા-જુદા વિષયો હપર વ્યાખ્યાન, શિબિર તથા ધાર્મિક સ્પર્ધાઓ, સાંજે પ્રતિક્રમણ યોજાયા છે તેવં સંઘ પ્રમખ વિનોદભાઈ મહેતાએ જણાવ્યું હતું. છ કોટી સ્થાનકવાસી જૈન

સંઘમાં ૫.પૂ. તમજ્ઞાબાઇ મ.સ. આદિઠાણા-૪ ની નિશ્રામાં પર્વની વિવિધ તપ-જપ સાથે ઉજવણી થશે. દરરોજ વ્યાખ્યાન, શિબીર, જાપ, યોજાયા છે. તેવું સંઘ પ્રમુખ ધીરજલાલભાઈ દોશીએ જણાવ્યું હતું. આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પ.પૂ. આ. ભ. મુલચંદજી સ્વામિ આદિઠાણા -૪ ની શુભ નિશ્રામાં પર્વ ઉજવાશે તેવું સંઘ પ્રમુખ શ્રી નીતીન

બાબુલાલ શાહે જણાવ્યું હતું. જૈન શ્વે. તેરા પંથ સંઘમાં આ. મહાશ્રમણજીના સુશિષ્ય મુનિ અનંતકુમારજી તથા મુનિ વિપુલકુમારજી આદિઠાણા-૨ ની નિશ્રામાં પર્વની ભવ્ય ઉજવણીથશે. દરરોજ વ્યાખ્યાન, તપારાધના, મહાવીર જીવન ચરિત્રનું વાંચન, તથા બાળકોના કાર્યક્રમો, પ્રતિક્રમણ યોજાયા છ તેવું સંઘ પ્રમુખ વાડીલાલ મહેતાએ જણાવ્યું હતું. શહેરના કોટ

સોસાયટી વિસ્તારમાં છ કોટી સંઘના જૈન ભુવન મધ્યે લીંબડી અજરામલ ૫.પુ. સ્વામીનાઆજ્ઞાનુવર્તીની

જિન ઉપાશ્રયોમાં

ચાર્તુમાસ બિરાજીત

જૈન-સાધુ-સાધ્વી

ભગવંતોની નિશ્રામાં

**આઠ દિવસ પર્વાધિરાજ** 

પર્વની વિવિધ

અનુષ્ઠાનો તપ-

આરાધના દ્વારા

કરાશે ઉજવણી

શેરડી સહિતના જિનાલયો

ઉપાશ્રયોમાં બિરાજીત જૈન

જૈન

પ્રારંભ કરાયો હતો.

ભગવંતોની

શ્રેષ્ઠીઓ.

સાધુ-સાધ્વી,

પર્વનો

રચનાકુમારીજી આદિઠાણા-૪ ની શુભ નિશ્રામાં પર્વ ઉજવાશે. વિવિધ આરાધનાઓ કરાવાશે. તેવું સંચાલન સમિતિના શ્રી જગદીશભાઈ મહેતા જીગ્નેશભાઈ શાહ તથા પ્રફુલ્લભાઈ દોશીએ જણાવ્યું હતું. ઉમેદનગર વાસુપૂજ્ય જૈન જિનાલયે પર્યુષ્ણ મહાપર્વની ઉજવણી કરાશે તેવું આરાધના ભવન જૈન સંઘે જણાવ્યું રાત્વના પાત્રના જેતે તેને જકાવનું હતું. ભુજ શહેરના સર્વમંગલ આરોગ્યધામપાછળ આવેલ દેવ અવેન્યુ સોસાયટી મધ્યે સંભવનાથ જિનાલયે પર્યુષ્ણ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનકરવામાં આવ્યું છે તેવું રહેવાસીઓએ જણાવ્યું હતું. વિજયનગર રથાકાર જિનાલય હતું. Luજનગર રચાકાર ાજનાલન તથા નવનીતનગર-કોવઈનગર મધ્યે પ. પૂ. સા. દીવ્યકીરણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં પર્વ ઉજવાશે. કેશર પુજા, આરતી, મંગલ દીવો, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, સ્નાત્રપુજા વિ. કાર્યક્રમો યોજાશે તેવું ક.વી.ઓ.

જશાવ્યું હતું. ભુંજ નજીક જૈનોના વર્ધમાનનગર-સાઉથ મધ્યે વર્ધમાન શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ દ્વારા ૫.પૂ.સા. અમિતવર્ધનાશ્રીજી પ.પૂ.સા. આમતવધનાશ્રાજી મ.સા. આદિઠાણા-ર ની શુભ પાવન નિશ્રામાં પર્યુપણ મહાપ ર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. સવારે વ્યાખ્યાન, બપોરે ધાર્મિક કાર્યક્રમો તથા રાત્રી માવનાનુંઆયોજન કરવામાં આવ્યું છે. વિમલનાથ પ્રભજીની નિત નવી ્ય અંગરચના કરવામાં આવશે તેવું રાહુલ મહેતા તથા હસમુખભાઇ વોરાએ જણાવ્યું હતું. વર્ધમાનનગર નોર્થ આદિનાથ સોસાયટી મધ્યે

જૈન મહાજન અધ્યક્ષ જીંગર છેડાએ

## ઉમા યોગ કેન્દ્ર દ્વારા મેગા યોગ ફિટનેશ

હતી. તેને દસ વર્ષ પુર્ણ થતાં મેગા યોગ ફિટનેશ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજમાં આવેલ ઉમા યોગ કેન્દ્રને સ્થાપનાના ૧૦ વર્ષ પુર્શ થતા ૧૧ વર્ષમાં પ્રવેશનિમિતે મેગા યોગ ફિટનેશ સેમિનારનું આયોજન કતા. ૨-૯ થી ૧૩-૯ સાંજે ૪.૪૫ થી ૬.૧૦ ચાલનારા સેમિનારમાં ભાગ લેનાર દરેક સંસ્થા, સ્કૂલને મોમેન્ટ્રો આપી હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પાથરણા, ખુરશીની વ્યવસ્થા કરાઈ છે. પાણીની બોટલ સાથે લાવવી વધુ માહિતી માટે ઉપયોગ કેન્દ્રનો સંપર્ક સાધવા જણાવાયું છે. ૧૧ દિવસ ચાલનારા સેમિનારમાં કવોલીફાઈડ યોગ ટીચૂરો સાથે યોગ અવેરનેસ અંગે માહીતી આપવામાં આવશે.

પાવન નિશ્રામાં આઠ દિવસ ઉત્સાહ પૂર્વ ચાલતા પર્યુષણ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં

**સેમિનારનું આચોજન** ભુજ : યોગભારતી આશ્રમના યોગગુરૂના આદેશની ઉપયોગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી મસ્તુ સાધના કેન્દ્ર, માનવ મંદિર, શંખેશ્વર મહુડીધામસીટી સ્કવેરનાં જિનાલયોમાં પ્રભુજીની નિત નવી આંગીરચના થશે. હોદેદારોને

### રાપર નગરપાલિકા જિલ્લો-કચ્છ हेन्डर निविद्या, वर्ष :- २०२४/२५

રાપર નગરપાલિકા જી. કચ્છ-ભુજ (ફોન નં.૦૨૮૩૦ ૨૨૦૦૧૧) દ્વારા ઓનલાઈન ટેન્ડર ઈજારદારશ્રીઓ પાસેથી રોડ રીસરફર્સીંગ ગ્રાંટ વર્ષ-૨૦૨૪/૨૫ હેઠળના કામો માટે ઓનલાઈન ભાવો મંગાવવામાં આવે છે. ઓનલાઈન ટેન્ડર http:// www.nprocure.com ઉપર જોવા મળશે. અને ટેન્ડર વેબસાઈટ પર ઓનલાઈન ારવાના રહેશે. ટેન્ડર રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં.

ઓનલાઈન ટેન્ડર ડાઉનલો <mark>ડ કરવાની</mark>	તાા.૨૭/૦૮/૨૦૨૪ થી ૦૩/૦૯/૨૦૨૪ના
તારીખ.	૧૮:૦૦ કલાક સુધી
ઓનલાઈન ટેન્ડર અપલો <mark>ડ કર</mark> વાની	તાા.૨૭/૦૮/૨૦૨૪ થી ૦૩/૦૯/૨૦૨૪ના
અંતિમ તારીખ.	૧૮:૦૦ કલાક સુધી
ટેન્ડર ફી, બાનાની રકમ અને રજીસ્ટ્રેશન	તા.૧૧/૦૯/૨૦૨૪ના ૧૮:૦૦ કલાક સુધી
અન્ય દસ્તાવેજ રજુ કરવાની તારીખ.	(૨જી. પોસ્ટ દ્વારા)
.0.022	

તારીખ: ૨૩/૦૮/૨૦૨૪ (નામાનિ/કચ્છ/૪૮૯/૨૦૨૪-૨૫)

ચીફ ઓફિસર નગરપાલિકા-રાપર

### ઘી ભુજ કોમર્શિયલ કો-ઓપ. બેન્ક લિ. હે. ઓ. ૧લો-૨જો માળ, સંતોષ ભવન, ન્યુસ્ટેશન રોક, ભુજ-કચ્છ. ૩૭૦ ૦૦૧. ફોન : ૨૫૨૬૯૦, ૨૨૦૮૭૩

### પર भी वार्षिड साधारण सભानी नोटिस

આથી ઘી ભુજ કોમર્શિયલ કો-ઓપરેદીવ બેંક લિ. ભુજના તમામ સભાસદત્રીઓને ખબર આપવામાં આવે છે કે, આ બેંકની બાવનમી વાર્ષિક સાધારણ સભા તા.૧૫/૦૯/<mark>૨૦૨૪ ને</mark> રવિવારના રોજ સવારના ૧૦,૦૦ કલાકે ત્રી ભુજ લોકાણા મકાજનવાડી,૭૭ ફળીયા,ભુજ-કચ્છ મુકામે નેચે જણાવેલ કાર્યસૂચિ માટે મળશે તો તેમાં અચૂક હજરી આપવા વિનંતી છે.

- ૧. તા.૨૪/૦૯/૨૦૨૩ ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લઈ બઠાલ રાખવા બાબત.
- બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા ભલામણ કરેલ તા. 39/03/2028ના રોજ પૂરા थतां वर्षनो अहेवाल, वार्षिङ सरयेथुं तथा नहा-नुडसाननो हिसाल अंपुर
- વર્ષ ૨૦૨૩-૨૪ નો ઓડિટ રીપોર્ટ વંચાણે લેવા બાબત
- 3. વર્ષ વેપઉંચ-૧૩ માં આ આઠદ રાયાદ વધા ભાગા મે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હતા ભલમણ કરેલ નફાની ફાળવણી અને ડિવિડન્ડ મંજુર રામવા બાબત. પ. બેંકના પેટા નિયમમાં સુધારા-વધારા બાબત ચેરમેનશ્રી તરફથી અથવા તેઓશ્રીની મંજૂરીથી રજૂ થાય તે થવા પ!.

## સ્થળ: ભુજ-કચ્છ તારીખ: ૩૦/૦૮/૨૦૨૪

બોર્ક ઓફ ડાયરેક્ટર્સના આદેશથી (ગૌતમ રાજેશભાઈ ઠકકર) भेनेशंग डायरेक्टर

नोंध : જો કોરમના અભાવ<mark>ે સભા મુલતવી રહેશે તો મુલતવી રહેલી</mark> સભા કરીથી અડધા કલાક બાદ તે જ દિવસે અને તે જ સ્થળે કાર્યસૂચિ મુજબના કામકાજ કરવા મળશે, જેમાં કોરમનો કોઈ બાદ્ય રહેશે નહિં.

- માધારણ સભામાં એજન્ડાના કામ સિવાય કોઈપણ પ્રકારની ચર્ચા હા<sup>શ</sup> પરવામાં આવશે નહીં. વરવામાં આવત પછા. જે સભાસદોને બેંકના વાર્ષિક અહેવાલ (હિસાબો)ની નકલ જોઇતી ફોચ તેઓએ
- જ તાભારદાળ બેકળા પાયક અહયાના (દારાખા) છો નહાર પારાદા ફાંચ તેઓ છે. કેડ ઓફિસ મોથી બેંકળા કામકાજના સમગ્ર દરમ્યાન મેળવી લેવા બિનેતી છે. બેંકના વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક હિસાબો અંગે ખુલાસો જોદંતો હોય તો સામાન્ય સભાની તારીખથી સાત દિવસ અગાઉથી બેંકની હેઠ ઓફિસમાં આવી ખુલાસો કરી- હોવા બિનેતી છે. તેમજ જે સભાસદ વાર્ષિક સાધારણ સભાની મિનિટસ વાંચવા માંગતા હોય તેઓ બેંકના કામકાજના સમય દરમ્યાન બેંકમાં
- ાનાલાટન પાર્ચિપ નાંગળા ફાંચ તળા ખડતા કાનકાં જના રામાં રહ્યાં ટ્રાયા બહાનો કુબરૂ આવી વાંગ્રી શકે છે. આ અંગેની ચર્ચા મેનેજરશ્રી સાથે કુબરૂમાં કરી શકાશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓરશ મુજબ બેંકના દરેક સભારાદ, ખાતેદાર તેમજ લોકર્સ ધારણ કરનારા બેંકમાં પોતાની ઓળખ તેમજ રહેઠાણના પુરાવા (K.Y.C.) આવા પર્કા પાતાના આળખ તેમજ રહે<mark>દાણના પુરા</mark>વા (K.Y.C.) આવવા પર્કારી છે. જેઓએ દજુ સુધી આવા પુરાવા આપેલ ન હોચ તેઓએ તાલ્કાલિક બેંકની હેડ ઓફિસ/ જે તે શાખામાં આવા પુરાવા પહોંચાડી જવા વિનંતી.
- વાર્ષિક સામાન્ય સભામાં આવનાર સભાસદે તેમનો સભાસદ નંબર અવશ્ય લાવવો.

મોટી પક્ષ જૈન સ્થાનક વર્ધમાનનગર મધ્યે ૫.પૂ. દર્શીતાબાઇ મ.સ. આદિઠાણા-૩ ની પાવન નિશ્રામાં પર્વ ઉજવાશે તેવું અશોકભાઈશાહે જણાવ્યું હતું. સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ

દ્વારા દરરોજ ગાયોને નિરણ આપ વામાં આવશે. માનવજયોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને તથાએકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ભોજનીયા જમાડવામાં આવશે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા વિવિધ સેવા કાર્યો કરાશે. તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા જીવદયાનું કાર્ય કરાશે.

. હુવહવાયુ કાય કહારા. અબડાસા મોટી પંચતીર્થીનાં રી-કોઠારા તેરા-જખૌ-સુથરી-કોઠારા ુ નલીયા-સાંધાણ-સાંધવ-શાયરા, વારાપદ્ધર, રાપરગઢવારી ગામોમાં

પર્યુષણપર્વ ઉજવવા અને તપારાધના કરવા ભાવિકો મુંબઇ અને દેશાવરથી માદરે વતન આવી પહોંચ્યા હોવાનું પ્રબોધ મુનવરે જણાવ્યું હતું. શિવ-મસ્તુ સાધાના કેન્દ્ર મધ્યે પુ. ઉપાધ્યાય પર્ણભદ્રસાગરજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં પર્વ ઉજવાશે તલવાણા નગરે ૫.પૂ. ગણિવર્ય રાજરત્નસાગરજી મ.સા., મુનિ શ્રી ભાગ્યોદયસાગરજી મ.સા., નિશ્રામાં પૂર્વ ઉજવાશે. સુથરી ગામે પ.પૂ. મુનિરાજ મલયસાગરજી મ.સા., કોઠારા ગામે પ.પૂ. સા. શ્રી જયધર્માશ્રીજી મ.સા., નલીયા ગામે ૫.પૂ. સા. જ્ઞાનગુણાશ્રીજી મ.સા., તેરા ગામે ૫. પૂ. સા ત્રાતા, તરા ખાત પ. પૂ. તા. જગતત્રયાશ્રીજી મ.સા., જખો ગામે પ.પૂ. સા. ચૈતન્યરક્ષિતાશ્રીજી મ.સા., સાંધવ ગામે પ.પૂ. સા. નંદિવર્ધનાશ્રીજી મ.સા. આદિઠાણા-૪ની નિશ્રામાં પર્વ ઉજવાશે. નાની કવા ભિશ્રામાં પંપ ઉજવારા. વાવા પંચતીર્થીનાં મુન્દ્રા, ભુજપુર, મોટી ખાખર, નાની ખાખર, બિદડા તથા નૂતન પંચતીર્થીનાં વાંકુ-વારાપધ્ધર-લાલા-પરજાઉ-રાપરગઢવારીમાં પણ પર્યુષણ પર્વની ઉજવણી આરંભાશે. ભુજ,માંડવી, ગાંધીધામ, અંજાર. ભુજ, માંડવા, ગાવાવાન, અજન્ડ, ભચાઉ, રાપર, નખગાશા, અબડાસા તથા જૈન વસ્તીવાળા ગામોમાં પર્યુપણ પર્વની તપારાધનાઓ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. વસહી જૈન તીર્થ ભદ્રસ્ય શ્રી બઉતેર જિનાલય, ગુણપાશ્વતીર્થ દેઢીયા, કટારીયાજી તીર્થ, વાંકી તીર્થ, પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ, શિવ-

અતિ વરસાદ પડે ત્યારે ગામમાં આવાગમન બંધ થઈ જાય છે : ગ્રામ પંચાયતના હોદ્દેદારો સાથે ગામવાસીઓએ વહીવટી તંત્ર પાસે કરી રજુઆત

મોથાળા : છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં પુષ્કળ વરસાદ પડી રહ્યો છે. ત્યારે અબડાસા તાલુકાના મોથાળા ગામે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગામને મુખ્ય માર્ગથી જોડતા રસ્તા પર આવેલ પુલની લંબાઈ ઓછી હોવાના કારણે વરસાદના સમયે ધસમસતા પાણીમાં પસાર થવામાં પરેશાની થઈ રહી છે. આ અંગે ગામમાં ગંભીર સ્થિતિ નિર્માણ થાય તે પહેલા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત તંત્ર પાસે ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ લાંબા સમયથી રજૂઆતો કરી હતી. આ પ્રશ્નના બાબતે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા અને સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત પ્રતિનિધિઓ સમક્ષ પણ

#### માનવજ્યોત દ્વારા ભૂપેન્દ્રસિંહ રાઠોડ અને હસમુખભાઈ ભુડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ભુજ : માનવજયોત સંસ્થા દ્વારા ભુપેન્દ્રસિંહજી જોરાવરસિંહજી રાઠોડ અને કચ્છી દાનવીર દાતા હસમુખભાઇ કાનજીભાઇ ભુડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. સંસ્થાનાં પ્રબોધભાઇ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોપી, આનંદ રાયુસોની, કનૈયાલાલ અબોટી, રફ્રીક બાવાુએ તેમની પ્રેમ, સદભાવનાની સરવાણીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

#### વેલસ્પન એન્ટરપ્રાઈસીઝ લિમિટેડ

વિસ્પેન એન્ટરમાંદર્સાં (નિમેટેડ CIN: 452tGJ1994PL:023920 રજી.કરોરી : વેલસ્પન સિટી, ગામ વામિકી, તા. અંજા, જિ. કરન, જુજરાત-3-૭-૧૧૦ દેશિ. નન ૧૮૩૧-૧૬૨૨૨૨ ફેક્સ નના ૧૮૩૧-૧૭ન૧૦ કોર્પોર્ટ ઓફિસ વેલસ્પન કાઇસ, કાલા સીટી, સેનાપતી ભાગ્ય આત્રે, તેમાર પરેલ (પશ્ચિમ), મુંબઇ - ૪૦૦૦૧૩, ટીલે : નન્૧ સ-૧૬૧૩૬૦૦ ફેક્સ : નન્૧ ૧૨-૧૪-૯૮૦૨૦ હેલ્લાઇ: www.welspunenterprises.com, લેઇલ્ડ companysecretary, wel@welspun.com વીડિયો કોન્ડરરસ/અન્ય એડિયો વિઝ્યુઅલ મીન્યના માદ્યમથી યોજાનારી ૩૦મી વાર્ષિક સાધારણ સભા, બૂક બંધની તારીખ તથા ફાઇનલ ડિવિકન્ડ અંગેનો માહિતી

સાઈનલ હિવિકન્ક અંગેની ગોહિતી
આથી આ નેહિસ હાર ગાઇ કરવામાં આવે છે કે, વેલ્લ્યન એન્ટરપ્રાપ્ટીપ્ર હિમિટેડ ('દ્દી કંપની')નાં સભ્યોની ૩૦મી વાર્ષિક સાંગ્રસ્થ સભા ગુસાર, ૧૬ સપ્ટેમ્પર, ૧૦૧૪નાં બપોરે ૧ વાર્ગ્ચ વીડિયો કોન્ફરન્સીંગ ('વીસી') / અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ ('ઓએવીએમ') મારલ સભા રહેવા ભર્ચનોની રૂવ્યુ (ખરિચેલિ વિનાયોપ્લમાં આવશે. જે અપી દારો, ૧૦૧૩ (એક્ટર)ની ખંગવાદમાં એને નિયમોનુશ્યાર, સમાનન્ય પરિપ્રથો હો એન્ટર ૧૦૧૩ (એક્ટર)ને ખંગવાદમાં એને નિયમોનુશ્યાર, ૧૦૧૩ અને નિયમોનુશ્યાર, ૧૦૧૩ અને અને કોર્ટના લેવ્યું (એનીએ') તથા પરિપ્ર ૧૩ મે, ૨૦૧૨, ૧૫ નાર્ટમાં કોર્યું અને અને ઓક્ટોબર ૧૦૧૩ (સંસું કોર્યન લેવ્યું કોર્યાર ('એન્ટીએ') તથા પરિપ્ર ૧૩ મે, ૨૦૧૨, ૧૫ નાર્ટમાં કોર્યના કોર્યોન્સ અને અને અને અને લેવ્યું કાર્યાર વર્ષિય કાર્યાર કાર્યાલ કોર્યાલી કોર્ય સભાવ વર્ષિયાની કેર્યોન્સ કેર્યાલ જે સંસ્થારી કિસે કેર્યાલ કેર્યોનું અને નાણાકીય વર્ષ ૧૦૧૩ -૧૫નો વાર્ષિક સ્થારો કોર્યાલ કોર્યાલ કિસિય કાર્યાલ કોર્યાલ કિસિય કાર્યાલ કોર્યાલ કોર્

૧) ૩૦મી એજીએમ નોટિસની સાથે ગાર્ષિક અઠેવાલ મેળવવા માટે છોઈલ સરનામું/ઓની નોંઘણી /અપડેટીંગ કરવાની રીત :

- નોંઘણી/અપહેર્તિંગ કરવાની રીત:
   જે સભ્યો કંપનીના શેર પ્રત્યક વ્યક્રપે ધરાવતા હેય પરંતુ કંપનીમ ઇમેઇલ સરનામું/ઓ
  નોંઘાયેલ નહીં હોય તેઓ ફોર્મ અઇએસઆર-૧ સાથે પાનકાર્કની સ્વયંપ્રમાણીત નકલ, અન્ય દસ્તવિજો (જેમકે આધા: કાર્ક, ફાઇમીંગ લાયસન્ય, ચૂંટણી ઓળખ કાર્ક, પારાપોર્ટ)ની સ્વયંપ્રમાણિત નાલ કંપનીનાં શેર સ્છન્સર તથા ટ્રાન્સફર એજન્ટ ('આરટીએ')ને સંબોધીને લિંક ઇનદાઇમ પ્રાઇટ હિમિટેક યુનિટ: વેલસ્થન એન્ટરપાઇઝ લિમેટેક, સી-૧૦૧, ૨૪૭ પાર્ક, સેલલીએસ માર્ગ વિકરોલી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૩ અથવા ઇમેઇલ mt.helpdesk@linkintime.co.in ઉપર મોકલી
- શકલા. કંપનીના શેર ડિમટીરીયલાઇઝ સ્વરૂપે ઘરાવતા રુવ્યોએ જે તે કિપોઝીટરી પાર્ટીસિપન્ટસ ('કીપીએરા') ખાતે ઇમેઇલ નોંઘણે /અપકેટ કરી દેવા વિનંતી. એજીએમમાં જોડાયા અને ઇંન્હેરિક મ્રારા મતદાનનીપન્નતિ: એઅજીએમ રસીમાના રહ્યો વીપી એએવીએમ મૃતિયા મારફત ૧ ભાગ લઈ શકશે. જેની સઘળી વિગતો એજીએમ નોર્ટિસમાંદશવિલ છે. વીરો/એએવીએમના માદમમથી જોડાયેલા
- સભ્યોની ગણતરીકાયદાની કલમ-૧૦૩ અનુસાર કેરમ તરીકે ગણારે. સભ્યોને એજીએમ નોટિસમાં :શવિલ કામગીરી અંગે રિમોર ઈ-વોર્ટીંગ પદ્ધતિ દ્વારા
- (3) બૂક બંધ તથા ફાઇનલ ડિવિડન્ડ : • બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૨૧ મે, ૨૦૨૪નાં મળેલી સભામાં ફાઈનલ ડિવિડન્ડ રૂ.૩/-શેર
- વર્ષ ('એકવાય') માટે ઈકવીટી ગેર ઉપર ૩૦ ટકા લેખે ભલામણ થયેલ છે જેની દરેક
- વર્ષ ("એકવાર્થ) માટે ઇક્વીટી ગેર ઉપર 30 ટાા લેખે ભલામાં ઘયેલ છે જેની ટરેક રાભ્યોએ નીંધ હેવી. ફાઇનલ ક્લિકન્ડ સભ્યોની મંત્રુરીને આધીત્ર રહીને સુવાર, ૨૬ માટેમ્બર, ૨૦૨૧ કે ભારાબાદ સભાનોના રજીસ્ટરામે લેખલ્લા નામે કૃષ્ણવામાં આવશે તથા સભ્યોનું રજીસ્ટર અને શેર ટ્રાપ્ટનકરબૂક શનિવાર, ૧ જુલાઈ, ૨૦૨૪થી સોમવાર, ૮ જુલાઈ, ૧૦૧૪ (બન્ને દિવસો સહિલ) બંધ રહેશે, () ક્લિકન્ડ એમવાયામાં ટે હંગની વિઝારે શારે કેવાયરની નોંધાકીની પહ્ની: રોબીનાં 3 નવેસ્બર્સ્સન, ૨૦૨૧ના પરિપત્ર સાથે આનુસંભિક પરિખો વંચાણે લઈને પાન, કેવાયસની વિગતો અને વારકારાની વીદાઈ, પ્રત્યક્ષ તિકાચીટિકી ઘારોએ પ્રત્યક્ષ સ્વર્ય શેર દાચવાતા કોય તેનીનાં ઘણી કરજીય રહેશે પતું જ કેવાઓનાં કોલિયો પાયારની વિગતો (જેવી કે: (૧) પાન (૨) વારસદારની પર્વટર્ગી (૩) સંપર્ક વિગતો (૧) એબાઈલ નંબર (૫) બેંક આતાની વિગતો અને (૧) રાશે માપેટ નહીં કરાયેલ કોય વાર રહ્યો કોઇપણ સૂકવણ ત્રેમકે ક્લિકિન્ક લાજે કમજૂર ફોલ્યોની કીક્યમલાની ૧ એપિલ, ૧૦૧૧થી અમલી સ્ક્રમ પ્રત્યક્ષ ફોલિકોમાં ઉત્તર કેવાયસની પ્રત્યે ક્લારી શેયા વર્ષ તે એમને લિક્સ કંપની પારે પ્રત્ય જામ શેય એ તે વા સભ્યોને કેવાયસની થાય કેવા તેમાં લે કમાનાં જયા કરવામાં પરત જમા થશે અને તેવા સભ્યોનં કેવાયસી થયા પછી તેમનાં બેંકખાતામાં જમા કરવામાં આવશે. તેથી સભ્યાએ પોતાના કેવચસી વહેલાસર સપડેટ કરાવી લેવ વિનંતી. • પત્થમ સ્વરૂપે છેર દારાવતા સભોએ પોતાનાં પાન કેવાયસી અને વારસદારની વિગતો
- અપ્રિએસઆર-૧, આપ્રિએસઆર-૧, આપ્રિએસઆર-૧, એમ્સએચન૧, કે લે ભૂપ પડતું છેવે તે પત્રકમાં સહી શકી સંપૂર્ણ ભદી કંપનીના આદીએને ઉદેશીને ફિન્ક ઇન્દ્રાપાઇ ઇન્ડિયા પ્રાપ્યુટિ (સિટેડ, ચૂનિર-વેલ્સ્પર્સ એન્ટ્ટરપાઇરીસ ઉસ્પ્રિટ, સેન્ટન), ૧૪૫ પાર્કે, એલબીએસ માર્ગ, વિકુશેલી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૮૩ને પહોંચાડવા અથવા પોતાના
- એલબીએસ માત્રે, વિકોશી (પરિમા), મુંલઈ-૪૦૦ ૦૮ ટકો પરિકાદના એવવા પોતાના સ્ટુઝરન્ટ કિમ્મિલ ઉપરથી mt helptesk@inkintme co in ને મેદલવા વિનંતી.

   ડીમટીદીયલાઇડ સ્વરૂપે શેર દોરવલા સંખ્યોએ નિના વિલંબે કિનિક્કની રકમ મેળવવા માત્રે તે કે ખાતાની સંપૂર્ણ વિનનો કીંગી પાસે અપડેટ ક્યાંવી હવા નિનંતી.

  123 નીટિસ કંપનામાં આવેલ છે, તેની તેના કાંગ એસપીએ અને સેબીના અસરકર્તા પરિપત્રોની રૂએ પ્રકાશિત કરવામાં આવેલ છે, તેનીકંપનીના તમાર ગલ્યોએ એછપ્રેમ નીટિસમાં દર્શવિલી સથા નિર્દાસ કરીને એછએમાં જોકાવાની સૂચના, દીમેદ ઈ-વોર્ટીઝ અને ઇ-વોર્ટીઝના માત્રસ્થારી મતદાન કરવાની દીત લાધ વીર્સી, બોએવીએમ માત્ર માત્ર ભાજીની લામમાં વિગતો કાળકપૂર્વક લોધના વિસંતી છે. એછએમાં જોકાવાની સ્વાના સ્વાન્ટની નામમાં વિગતો કાળકપૂર્વક લોધના વિસંતી છે. એછએમાં જોકાવાના ત્યાં પ્રસંતી સ્વીપત્રી સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં પ્રસંતી સ્વીપત્રી કોઈપણ સુરેદીની જ્યારા કોઈપણ સુરેદીની જોઇપણ સુરેદીની જાણ સ્વાન્ટની સ્વાન્ટના ત્યાં પ્રસંતી સ્વીપત્રમાં સ્વીપત્રમાં સ્વાન્ટના ત્યાં પ્રસંતી સ્વીપત્રમાં સ્વીપ્રયાભાગા ત્યાં પ્રસંતીના સેઠીસીનો સંત્રસંતી સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં પ્રસંત્રના સેઠીસીનો સંત્રસંત્ર સંત્રસંત્રના સેઠીસીના સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં ત્યાં સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં સ્વિત્યા સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં સ્વાન્ટના ત્યાં સ્વાન્ટના સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં ત્યાં સ્વાન્ટના સ્વાન્ટના સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં ત્યાં સ્વાન્ટના સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં સ્વાન્ટના ત્યાં સ્વાન્ટના સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં સ્વાન્ટના સ્વાન્ટના સ્વાન્ટના ત્યામ સ્વાન્ટના સ્વાન્ટના ત્યાં સ્વાન્ટના સ્વાન્ટન જારાાય તો, Companysecretay\_wel@welspun.com ઉપરકંપની સેકેટરીનો સંપર્ક સાધી શકશે.

મુંબઇ, ઓગસ્ટ ૩૦, ૨૦૨૪

વેલસ્પન એન્ટરપ્રાઈસીઝ લિમિટેક વતી

સહી/-निधि तन्ना કંપની સેક્રેટરી ACS-30465



રજૂઆતો કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના સરપંચ વિવેક ડાબી સહિત વિવિધ અગ્રણીઓ આ પ્રશ્નનો ઝડપથી ઉકેલ આવે તે જરૂરી છે. આ મુદ્દે ગ્રામ પંચાયતના સદસ્ય જોશી કવિતાબેન પંકજભાઈએ પણ આ બાબતે વિવિધ અગ્રણીઓને એક થઈને આ મુદ્દો ઉપાડવા લખેલ પત્ર પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

બે વર્ષ અગાઉ બનેલ પુલ આ વરસાદમાં ધોવાઈ ગયો હોવાથી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. પુલની સાઈડમાં પીડબલ્યુડી દ્વારા માટી નાખવામાં આવી છે, તે બરાબર નથી. હવે જ્યારે સમારકામ હાથ ધરાય ત્યારે માટી ન નાખી પુલની જ લંબાઈ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલ

પુલના પ્રશ્ને વિવિધ અગ્રણીઓ કાયમી ધોરણે રિપેરીંગ કામ કરાય તેવી માંગ અનંત ભાનુશાલી, પ્રફુલ ગોરી, જયેશ મંગે, દિપક આયડી, પી. ડી. રાણા, એ.એસ. રાયમા, જાડેજા શક્તિસિંહ, હિરેનપુરી રમેશપુરી, મામદ દાઉંદ, રમેશ અબોટી, સોઢા ભુરૂભા, મહેશ્વરી નરેશ નાનજી, જોશી દિનેશ મુરજી, જોગી દયારામ ગાભા, ભાનુશાલી હંસરાજ કલ્યાણજી, દરજી રાજેશ, ઈમ્તિયાઝ દાઉદ, હીરજી જખુ મહેશ્વરી વગેરેએ રજૂઆત સૂર પૂરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે. હાલ મોથાળા ગામના પુલ ઉપરાંત ગામમાં ફટી નીકળેલા નડતરરૂપ દબાણોને દૂર કરવા માટે પણ રજૂઆત કરાય તેવી પણ માંગ ઉઠવા પામી છે.

#### અફ્ડ હડાએ

કચ્છ જિલ્લાના રાપર તાલુકાની શ્રી ભુટકિયા પ્રા. શાળાના ૫ (પાંચ) જર્જરિત એરકા તોડી નાખીને કાટમાળ ખસેડી જમીન સમથળ કરી આપવાની હરાજી શ્રી ભુટકિયા પ્રા.શાળા ખાતે તારીખ ૦૫/૦૯/૨૦૨૪ ને સવારે ૧૦:૦૦ કલાકે રાખેલ છે. તો રસ્ ધરાવતા લોકોએ હાજર રહેવુ. શરતો સ્થળ પર જણાવવામાં આવશે.

ચૌઘરી અશોકભાઈ એય. ม).ai. - เอล/ลนอลนรล

S.M.C. અધ્યક્ષ, ભૂટકિયા પ્રા.શાળા પરમાર વેલાભાઈ આર. भो.नं. - ६९८७८६०८७६

vens **વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લીમીટેડ** (અગાઉ બિલગ પાઈપસ એન્ડ ટ્યુલ્સ પ્રાઇશ્ટે લિંમિટેક તરીકે ઓળખાતી) CIN NO. L74140GJ2015PLC082306 રજી. ઓફીસ : સર્વે નં. સરાત્રે રે, સરાત્રે /૧, ઘાણેટી, ભૂજ (કરછ-૩૯૦૦૨૦) ગુજરાત, ઇન્ડીયા. ફોન્ન : +૯૧ ૨૮૩૬ ૨૩૨૧૮૩/૮૪ [Email: cs@wnusppes.com

#### ૧૦મી વાર્ષિક સામાન્ય સભાની સૂચના રિમોટ ઈ-વોર્ટિંગ અને અન્ય માહિતી પરની માહિતી

- તમામ સભ્યોને વધુમાં જણાવવામાં આવે છે કે: a. એજીએમની નોટિરમાં દર્શાવ્યા મુજબ સામાન્ય અને વિશેષ કારોબારઘઈ શકે છે એજીએમ દરિયાના સ્ત્રીય વેપીટિંગ અથવા ઈ-વોર્ટિંગ સિસ્ટમા મારા મતદાન નોટ કરવામાં આવશે. છે. સ્ત્રીય ઇ-વોર્ટિંગ સમાચાગાં શાનિભર, સપ્ટેમ્બર ૧૧, ૨૦૨૪ (0000 AM IST) ના રોજ શરૂ શરો અને મંગવાવાર, સપ્ટેમ્બર ૧૪, ૨૦૨૪ (000 PM IST) ના રોજ સમાપ્ત શોધ છે. ત્યાર બાદ Kintech મૂકા ઓઠ ઇ-વોર્ટિંગ કરવામાં આવશે. એકવાર દરાવ પર મતદાન થઈ જાય રબ્ય, તેને/તેણી/તેને પછીશી તેને બદલવાની મંત્રી આપવામાં આવશે
- જણ. રિમોટ ઈ-વોર્ટિંગ કારા મત આપવા માટે સભ્યોની વોગ્યતા નુક્કી કાવા માટેની કટ-ઓફ (રક્ષાંદ છે 'આવત') કાર્ય તા આપવા માને વર્ષ્યાં સાથવાના કોંગ કોંગ કોંગ કોંગ તારાના દર ' જા લાંગિ અંધા એકએમ બૂંદાવાર, ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ માં દો' કે છે. વધુમાં 'જણાવવામ આવ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ઉરિક્ટર્સ ભાગરા કરી છે 31 માર્ચ, ૧૦૨૪ માં કર્યા કર્યા કરો કરે દર્શ કર્યું ના સામાન મૂલ્ય પડ ૧૦૫૦/- પ્રતિ ઇમ્પિટી શેર (પડ્ડ) નું અંતિમ ક્રિપિકન્ડ તે સભ્યોને કોર્ડ તારીએ એટલે કે ૧૮ સપ્ટેમ્બર, ૧૨૪ સભ્યોની મેન્ટ્રીએ આધીન છે. કંપનીની આગામી વાર્ષિક સામાના સભામાં ઉરિક્ટન્ડ એ ગુએમાની લાર્પિક સામાના સમામાં ઉર્લાઇન્ડ એ ગુએમાની લાર્પિક સામાના સમામાં ઉર્લાઇન્ડ એ ગુએમાની લાર્પિક સામાના સામ

સભામાં કિલિડન્ડ એજીએમની તારીમેથી 30 ટિવરની અંદર ચૂકુવવામાં આવશે. કોંદિપાટ વ્યક્તિ કે કંપનીના શરે સે મેગલે છે અને હ્વરની અંદર ચૂકુવવામાં આવશે. કોંદિપાટ વ્યક્તિ કે કંપનીના શરે સે મેગલે છે અને હવતી મેડે ચૂવાવા, માટે સો મેડવા પછી કંપનીના સ્વાર અને છે અને હવતી સે સે પ્રાથમિક કોંદિ કે ધૂવાવા, માટે સમેહના, ૨૦૨૪ના રેપ કોંદિના માટે સે સાથક કોંદિ કર્યા છે. તે વારા પછી કોંદિ કર્યા છે. તે વારા કોંદિ કર્યા છે. તે વારા કોંદિ કર્યા છે. તે કોંદિ કર્યા છે. કોંદિ કર્યા કે હાર્યા કરે હાર્યા કરે હાર્યા કરે હાર્યા કરે હાર્યા કે હાર્યા કરે છે. તે તે હવતા કર્યા કરે હાર્યા કરે હાર્યા કરે હાર કર્યા કાર્યા કરે હાર્યા કરે હાર્યા કરે હાર્યા કરે હાર્યા કરે હાર્યા કરે હાર કર્યા કાર્યા કરે હાર કર્યા કાર્યા કરે હાર કર્યા કાર્ય કરે હાર કર્યા કાર્યા કરે હાર કર્યા કાર્યા કરે હાર કર્યા કાર્ય કરે હાર કર્યા કાર્યા કરે હાર કર્યા કાર્ય કરે હાર કર્યા કાર્ય કરે હાર કર્યા કાર્યા કરે હાર કરે હાર કર્યા કાર્ય કરે હાર કરે હાર કર્યા કાર્ય કરે હાર કર્યા કાર્ય કરે હાર કરે હાર

ઉપલબ્ધ છે. Kinnteon ના વબસાઇટ અલ્દરા ક. παρεπνον.Απισοπισοπι કંડનાંગ્રીએ સેસર્વે પિલ્પુ પ્રખાવનિ એક એસોસિએટસંકમાંથી શ્રી પિયુ ખાબુભાઇ પ્રખાવતિ (સભ્યતા નંબર FCS ૧૨૭૧૧ અને CP નં, ૧૮૩૩૧) ની સ્કુટિનાઇટર તરીકે નિમણક કરી છે. ફેલ્લી એએએએ અને ઇંન્હીઉર્જે પોલા સિમેક ઇન્ડિંગની ચકાસણીકરી શકાય. એએએએ દરમિયાન વાજબી અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા.

ઇ-વોર્ટીંગ સંબંધિત ઇપલબ્ધ અને ઇ-વોર્ટિંગ વપરાશ કર્તા માર્ગદર્શિકા માટે FAQ નો સંદર્ભ લો અશ્વા ટોલ્ફી નંબર પર ક્ષેલ કરો: ૧૮૦૦-૩૦૯-૪૦૦૧

કેફિલ ટેક્લોરોજીસ સિમિટેડ, કુલિટા વિલસ પાઇપ્સ એન્ડ ટ્રણબ્ટ હિમિટેડ, સેરોલિયમ દાયદ છી, લોદ લાંબર-૩૧ અને ૩૨, ડાઇમાન્ટિયાઇ હિનિકદ, નાતકરામસુદા, ત્રે રિપ્તિગ્ય-૧૯(૧), કેંદ રાષાદ (ટી.જ) ૧૫૦૦ ૭૩૨ ઇમેલ આઇડી: einward.ts@kintech.con, વેબસાઇટ www.kintech.con

કંપની cs@venuspipes.com પર મેઇલ લખો.

sudi cogvenisppes.com પર માત લખા. સભ્યો મેઠ એકએક દરતાનેએ અદેવા સુત્રર આઇડી અને પાસવર્ક શંભવવાની રીત ઇમેલ રસ્તામું કંપની / ઉપોડિસ્ટીમાં નોંધાયેલ નદી નીચે મુજબ છે: જ ભ્રભ્યોએ તેમનું પ્રયોગ રસ્તામું રજીસ્ટ કરાવ્યું નદી તેઓને વિનંદી કરવામાં આવે છે કે તેઓ કંપનીના શરિવર્ડ્ડએ અને દ્રાન્યસ કર્યામાં અલ્લે છે. einward.ris@kfintech.com અથવા દંપનીને cs@venuspipes.com પર AGM Eસ્તાવેઓ 

સભ્યો ફોલિયો નંબર, શેરધારકનું નગ, શેર પ્રમાણપત્રની રકેન કરેલી નકલ (આગળ અને કોલ્ડિંગ પાછળ), પાન (પાન કાર્ડની સ-પ્રમાણિત રકેન કરેલી નકલ), અધાર (આધાર કાર્ડની स्य-प्रभाशित स्त्रेन हरेती नहर)

કોપી આઇડી અને કલાગેંટ આઇડી (૧૬ માંક DPID + CLID અથવ ૧૬ અંકનો ભાગાર્થી હોલ્લિંગ ID), રોરધારકનું નામ, કલાગેંટ સસ્ટર અથવા એકીકૃત એકાઉન્ટર રેડેસેન્ટરની નકલ, PAN કોક્રેટ મોક કાર્ડની સ્ટન્પ મમાહિત સેન કરેલી નકલ), AADHAR (સ્વ-પ્રમાહિત આધાર કાર્ડની સ્ટેન કોપી)

ફોર, **વિનસ પાઇપ એન્દ ટ્યુબ્સ લીમેટિક પવન કુમાર જેન** (કંપની સેકેટરી) (મેમ્બરશીપ નં.: A66752) તારીખ : ૩૦.૦૮.૨૦૨૪ સ્થળ : ઘાણેટી

#### 18:00 કલાક સુધી તા.30/08/2024 થી 11/09/2024ન ઓનલાઈન ટેન્ડર અપલોડ કરવાની અંતિમ તારીખ. 18:00 કલાક સુધી ટેન્ડર કી. બાનાની રકમ અને રજીસ્ટેશન તા.11/09/2024 થી 13/09/2024ન અન્ય દસ્તાવેજ રજુ કરવાની તારીખ. 18:10 કલાક સુધી (૨જી. પોસ્ટ દારા) ઓનલાઈન પ્રાઈઝ બીડ ખોલવાની તા.17/09/2024 ના 12:00 કલાક

તારીખ. (શક્ય હશે તો) ચીક ઓક્સિર ભયાઉ નગરપાલિકા (નામાનિ/કચ્છ/૪૯૨/૨૦૨૪-૨૫)

No: JDA/EE&TA to Dir.Engg.-1/2024-25/D-60

# FINANCIAL EXPRESS

Dated: 30.08.2024

## JAIPUR DEVELOPMENT AUTHORITY Indira Circle, Jawahar Lal Nehru Marg, Jaipur-302004

NOTICE INVITING BID

NIB No. : EE & TA to Dir.Engg.-1/13/2024-25

Bids are invited from interested bidders for following works :-

S. No.	UBN No.	Cost of Work (Lacs)	Nature of Work	Last Date
1.	JDA2425WSOB00254	207.92	Plantation	19.09.2024
2.	JDA2425WLOB00259	2785.87	Construction of Nallah & Drain	04.10.2024

Other particulars of the respective bid may be visited on Procurement Portal website www.sppp.rajasthan.gov.in www.eproc.rajasthan.gov.in and www.jda.rajasthan.gov.in.

**Executive Engineer 8** TA to Dir.Engg-I Raj.Samwad/C/24/4502

## WINRO COMMERCIAL (INDIA) LIMITED Read, Office: 209/210, Arcadia Building, 2<sup>et</sup> Floor, 195, Nariman Point, Mumbai - 400 021

Telephone: 022-40198600, Fax: 022-40198650, CIN: L51226MH1983PLC165499 Email id: winro.investor@gcvl.in. Website: www.winrocommercial.com

## NOTICE OF THE FORTY FIRST (41<sup>51</sup>) ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the FortyFirst (41") Annual General Meeting ("AGM") of the Company will be held on Thursday, 26" day of September, 2024 at 11.30 A.M. via Video Conference / Other Audio Visual Means in compliance with the provisions of the Companies Act, 2013 read with to General circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 20/2021, 21/2021, 3/2022, 11/2022 and 09/2023 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 8, 2021, December 14, 2021, May 5, 2022, December 28, 2022 and September 25, 2023 respectively issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No.SEBI/HQ/ CFD/ CMD2/CIRP/P/2022/62 dated May 13, 2022, Circular No.SEBI/HO/CFD/PoD-2/P/ CIR/2023/4 dated January 5, 2023 & Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/ 2023/167 dated October 07, 2023 issued by the Securities and Exchange Board of India (SEBI) to transact the business as set out in the notice convening the AGM ("Notice") The venue of AGM shall be deemed to be the Registered Office of the Company.

The Notice of the 41" AGM along with the Annual Report for the Financial Year 2023-24 will be sent only by electronic mode to members whose email addresses are registered with the Company/Depositories Participants ("DP's")/ Registrar and Transfer Agent viz. Link Intime India Private Limited ("RTA"), in accordance with the aforesaid MCA Circulars and SEBI Regulations. The requirement of sending physical copies of Annual Report has been dispensed with in accordance with the aforesaid circulars. However the physical copies of Notice of AGM along with the Annual report shall be sent to those members who shall request for the same at winro.investor@gcvl.in.

Register of Members and Share Transfer Books of the Company will remain closed from 19" September, 2024 to 26" September, 2024 (both days inclusive). The Notice and the Annual Report will also be available on the website of the company at www.winrocommercial.com & website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com. Members can attend and participate in the AGM only through VC/OAVM. Members attending the Meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. In case of any queries write an email at evoting@nsdl.com or contact NSDL tearn - Ms. Rimpa Bag at Tel no.: 022-48867000 who will also address the grievances connected with the voting by electronic means. Members may also write to the Company Secretary at winro.investor@gcvl.in, or the registered office address.

In case members who have not registered their e-mail address are requested to register the same in respect of shares held in electronic form with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by writing to the Company's Registrar and Share Transfer Agent, Link Intime India Private Limited at C-101, 1 Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli West, Mumbai- 400 083.

The procedure and instructions for joining AGM through VC/OAVM and detailed procedure and instructions for casting votes through remote e-voting or e-voting during the AGM for all Members (including the Members holding shares in physical form/ whose email addresses are not registered with the DPs/Company/RTA) are stated in the Notice.

Members are also requested to furnish/update valid PAN to the RTA. In this connection, the following forms as notified by SEBI, can be downloaded from the Company's website at https://www.winrocommercial.com/investor-services.asp

 Form ISR-1 (Request for registering PAN, KYC details or changes / updation thereof); Form ISR-2(Confirmation of Signature of shareholders by their banker);

Form SH-13 (Nomination form). For Winro Commercial (India) Limited

Place: Mumbai Date: 30th August, 2024

Jitendra Parihar Company Secretary Membership No.: A40734

# Indiabulls

Indiabulls Enterprises Limited CIN: U71290HR2019PLC077579

Registered Office: 5th Floor, Plot No. 108, IT Park, Udyog Vihar, Phase 1, Gurgaon - 122 016, Haryana Tel: 0124-6685 800 Website: www.indiabullsenterprises.com Email: chadda.deepak@ibenterprises.in

#### PUBLIC NOTICE OF CONVENING 6TH ANNUAL GENERAL MEETING THROUGH VC / OAVM

Notice is hereby given that the 6th Annual General Meeting ("AGM") of the Members of Indiabulis Enterprises Limited ("the Company") will be held on Thursday, September 26, 2024, at 2:30 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), for which the Company has made arrangements through KFin Technologies Limited ("KFintech"/ "RTA"), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and Securities and Exchange Board of India ("SEBI"), to transact the businesses set out in the Notice calling the AGM. Members attending the AGM through VC/OAVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

In accordance with the relevant circulars, the AGM Notice and the Annual Report for the financial year 2023-24 comprising of Financial Statements, Board Report's, Auditor's Report and other documents required to be attached therewith ("Annual Report"), will be sent in due course, only by email to all those Members, whose email addresses are registered with the Company or the Depository's Participant(s) ("DPs")/ Registrar and Share Transfer Agent. The aforesaid documents will also be available on the website of the Company viz.www.indiabullsenterprises.com and also on the Website of the Stock Exchange(s) i.e. BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com respectively. The AGM notice and Annual Report will also be available on

### the website of KFintech at https://evoting.kfintech.com. Manner of casting vote(s) through e-voting:

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its Members to cast their votes on all the resolutions set out in the AGM Notice. The Company is also providing the facility of voting through e-voting system during the AGM ("e-voting") to those Members who could not cast their vote(s) by remote e-voting. The detailed procedure for e-voting before the AGM ("remote e-voting"). as well as during the AGM ("e-voting") and participation in the AGM through VC/OAVM, has been provided in the notes to AGM Notice which will be sent in due course, and shall be available on the websites of the Company, KFintech and Stock Exchange(s), as above.

Links for remote e-voting and joining AGM through VC/OAVM facility for Members. including for such Members who are holding shares in physical form, are provided below. Members are requested to carefully read all the Notes set out in AGM Notice and in particular, instructions for joining the AGM and manner of casting votes through e-voting.

Link to VC / OAVM	https://emeetings.kfintech.com/
Link for remote e-voting	For Individual Members: https://www.evoting.nsdl.com/ (holding securities in demat mode with NSDL) https://www.cdslindia.com/ (holding securities in demat mode with CDSL) For non-Individual Members and Members holding shares in physical form: https://evoting.kfintech.com.

# Manner of registering/updating e-mail address:

Place: Gurugram

Date: August 30, 2024

- a) Members holding shares in physical mode, who have not registered/updated their e-mail address with the Company, are requested to register/update their e-mail address by submitting Form ISR-1 (available on the website of Company and RTA at www.indiabullsenterprises.com and https://ris.kfintech.com/clientservices/isc/default.aspx, respectively) duly filled and signed along with the supporting documents to KFin Technologies Limited, Selenium, Tower B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda. Senlingampally, Hyderabad Rangareddy - 500 032, Telangana.
- ) Members holding shares in dematerialized mode, who have not registered updated their e-mail address, are requested to register/update their e-mail address with the Depository Participant(s), where they maintain in their demat accounts. By Order of the Board

For Indiabulls Enterprises Limited Deepak Chadda

Company Secretary Membership No.: ACS: 62593

### RajCOMP Info Services Limited (RISL) C-Block, 1st Floor, Yojana Bhawan, Tilak Marg, C-Scheme, Jaipur

RISL invites e-bids from the eligible bidders for the following:

instance of side from the englishe stade is for the removing.			
NIB No./ Date/	Particulars	Estimated	Start of sale
Unique bid no.		Cost/ EMD	/Last date
F4.3(607)/RISL/	Short Term RFP for Hiring	Rs. 3.40 Crores /	29/08/2024
Tech/2024/4150	Services of OEM Oracle	Rs. 6,80,000.00	12/09/2024
Dated : 28.08.2024	Resources under Jan Aadhaar		
UBN No.:	and e-Mitra Project for a		
RIS2425SLOB00038	period of Two Year.		

Details can be seen on the websites http://risl.rajasthan.gov.in http://sppp.rajasthan.gov.in, http://doitc.rajasthan.gov.in. Bids are to be submitted through http://eproc.rajasthan.gov.in Raj.Samwad/C/24/4450

# SARASWATI COMMERCIAL (INDIA) LIMITED

Regd. Office: 209/210, Arcadia Building, 2" Floor, 195, Nariman Point, Mumbai - 400 021 Telephone: 022-40198600, Fax: 022-40198650 CIN: L51909MH1983PLC166605 Email id: saraswati.investor@gcvl.in, Website: www.saraswaticommercial.com

## NOTICE OF THE FORTYFIRST ('41') ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the Fortyfirst (41") Annual General Meeting ("AGM") of the Company will be held on Thursday, 26" day of September, 2024 at 2.30 P.M. via Video Conference / Other Audio Visual Means in compliance with the provisions of the Companies Act, 2013 read with to General circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 20/2021, 21/2021, 3/2022, 11/2022 and 09/2023 dated April 8 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 8, 2021, December 14, 2021, May 5, 2022, December 28, 2022 and September 25, 2023 respectively issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No. SEBI/HQ/CFD/ CMD2/CIRP/P/2022/62 dated May 13, 2022, Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 & Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 07, 2023 issued by the Securities and Exchange Board of India (SEBI) to transact the business as set out in the notice convening the AGM ("Notice"). The venue of AGM shall be deemed to be the Registered Office of the Company.

The Notice of the 41" AGM along with the Annual Report for the Financial Year 2023-24 will be sent only by electronic mode to members whose email addresses are registered with the Company/Depositories Participants ("DP's")/ Registrar and Transfer Agent viz. Link Intime India Private Limited ("RTA"), in accordance with the aforesaid MCA Circulars and SEBI Regulations. The requirement of sending physical copies of Annual Report has been dispensed with in accordance with the aforesaid circulars. However the physical copies of Notice of AGM along with the Annual report shall be sent to those members who shall request for the same at saraswati.investor@gcvl.in.

Register of Members and Share Transfer Books of the Company will remain closed from 19" September, 2024 to 26" September, 2024 (both days inclusive). The Notice and the Annual Report will also be available on the website of the company at www.saraswaticommercial.com & website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com. Members can attend and participate in the AGM only through VC/OAVM. Members attending the Meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. In case of any queries write an email at evoting@nsdl.com or contact NSDL team - Ms. Rimpa Bag at Tel no.: 022-48867000 who will also address the grievances connected with the voting by electronic means. Members may also write to the Company Secretary at saraswati.investor@gcvl.in or the registered office address. In case members who have not registered their e-mail address are requested to register the same in respect of shares held in electronic form with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by writing to the Company's Registrar and Share Transfer Agent, Link Intime India Private Limited at C-101, 1"Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli West, Mumbai- 400 083.

The procedure and instructions for joining AGM through VC/OAVM and detailed procedure and instructions for casting votes through remote e-voting or e-voting during the AGM for all Members (including the Members holding shares in physical form/ whose email addresses are not registered with the DPs/Company/RTA) are

Members are also requested to furnish/update valid PAN to the RTA. In this connection the following forms as notified by SEBI, can be downloaded from the Company's website at https://www.saraswaticommercial.com/investor-services.asp

 Form ISR-1 (Request for registering PAN, KYC details or changes / updation thereof); Form ISR-2(Confirmation of Signature of shareholders by their banker);

3. Form SH-13 (Nomination form).

For Saraswati Commercial (India) Limited

Place: Mumbai Date : 30" August, 2024

Avani Sanghavi Company Secretary Membership No.: A29108

# INDONG TEA COMPANY LIMITED

CIN:L01122WB1990PLC050506 Regd. Office: Sikkim Commerce House, 4/1 Middleton Street, Kolkata - 700 071, India, Phone: 033 4006 36601, Email id: cs@indongteaco.com, Website: www.indongteaco.com

### NOTICE OF 34TH ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE INFORMATION

NOTICE is hereby given that the 34th Annual General Meeting (AGM) of the Members of he Indong Tea Company Limited ('the Company") is scheduled to be held on Tuesday, September 24, 2024 at 11:00 A.M (IST) through Video Conference ("VC") / Othe Audio-Visual Means ('OAVM') to transact the business set out in the Notice of AGM. Members attending the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

In accordance with General Circulars issued by the Ministry of Corporate affairs, vide its General Circular Nos. 14/2020 dated 8th April, 2020, No. 17/2020 dated 13th April, 2020, No. 20/2020 dated 5th May, 2020, No. 02/2021 dated 13th January, 2021, No. 21/2021 dated 14th December, 2021, No. 2/2022 dated 5th May, 2022, No. 10/2022 dated 28th December, 2022 and No. 09/2023 dated 25th September, 2023, ("MCA Circulars") and Securities and Exchange Board of India vide its Circular Nos. SEBI/HO/CFD/ CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May, 2022, SEBI/HO/ CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January, 2023 read with Master Circular No. SEBI/HO/CFD/PoD2/CIR/P/2023/120 dated 11th July, 2023 and SEBI Circular No. SEBI/HO/CFD/CFDPoD-2/P/CIR/2023/167 dated 7th October, 2023 respectively, issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars"), permitted companies to conduct Annual General Meeting ("AGM") through Video Conference ("VC")/ Other Audio Visual Means ('OAVM'), without the physical presence of the Members at the AGM

The AGM of the Company being held through VC / OAVM without the physical presence of Members at the Registered Office of the Company.

Electronic dispatch of the Annual Report, 2023-24, along with the AGM Notice have been completed on Friday, August 30, 2024. The Notice of the AGM is also available on the website of the BSE Limited (at www.bseindia.com). Notice is further given that the Company is providing electronic voting facility to the members to exercise their votes on all the resolutions set forth in the Notice of AGM. The Company has engaged NSDL for providing e-voting facility. In compliance with the aforesaid circulars, the Notice of AGM and Annual Report of F.Y. 2023-24, have been sent only through electronic mode to all the members whose e-mail addresses are registered with the Company or Depository Participants (DP), as the case may be. The physical copy of the Annual Report will also be sent to the members at their registered address who request for the same. However, Members including Members who have not registered their E-mail addresses with the Company/DP can download the AGM Notice and Annual Report from the Company's website i.e. https://www.indongteaco.com/ and the same is also available on the website of the BSE Limited at www.bseindia.comand on the website of NSDL at

www.evoting.nsdl.com. Remote e-voting and e-voting during the AGM

- Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of Companies (Management & Administration Rules), 2014 as amended from time to time, the Secretarial Standards on General Meetings issued by the Institute of Company Secretaries of India (ICSI) and Regulation 44 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015, as amended and the MCA Circulars the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system ('Remote e-voting')
- The remote e-voting period commences on Saturday, 21st September, 2024 at 09.00 A.M.(IST) and will end on Monday, 23rd September, 2024 at 05.00 P.M.(IST). During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL thereafter.

3.A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. Monday, 16th September, 2024, only shall be entitled to avail the facility of remote e-voting well as voting in the General Meeting.

. Those Members who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

. The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again. Any person, who acquires shares of the Company and becomes a Member after the Notice has been sent electronically and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

The Board of directors has appointed Ms. Puja Pujari, Practicing Company Secretary (FCS No. 13102, COP No. 20171) proprietor of Puja Pujari & Associates as the Scrutinizer to scrutinize the entire remote e-voting process in a fair and transparent In case of any queries pertaining to e-voting, members may refer to FAQs and the e-

voting manual available at www.evoting.nsdl.com, under help section or contact at 022 -4886 7000 and 022 - 2499 7000. In case of any grievances relating to e-voting, please contact Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL atevoting@nsdl.co.in. 8. Shareholders holding shares in physical mode and whose email IDs are not registered

are requested to register their email IDs with Cameo Corporate Services Limited, Registrar and Transfer Agent (RTA) at cameo@cameoindia.com mentioning their Name as registered with the RTA. Address, email ID, Mobile Number, self-attested copy of PAN, DPID/Client ID or Folio Number and number of shares held. Members holding shares in dematerialised mode are requested to register/update their email address with the relevant Depository Participants. As per the aforesaid MCA Circulars and SEBI Circulars, no physical copies of the Annual

Report will be sent to Members, except to those Members who have requested for physical copy of the Annual Report. Details of Book Closure Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rules made thereunder and

as per Regulation 42 of SEBI (Listing Obligations & Disclosure Requirements)

Regulations 2015, as amended, the Register of Members and Share Transfer books of the

Company will remain closed from Tuesday, September 17, 2024 to Tuesday, September 24, 2024 (both days inclusive) for taking record of the members for the purpose of the 34th AGM of the Company.

For Indong Tea Company Limited Chandan Gupta Place : Kolkata Company Secretary Cum Compliance Officer Date: 30th August, 2024 Membership No.: A55681

# SILKFLEX POLYMERS (INDIA) LIMITED

CIN: L51909WB2016PLC215739 Regd. Office: Daga Complex, Sulati Jaladhulagori, Sankrail, Howrah, West Bengal, India, 711302 Contact No.: + 91 81008 62015

Email: investors@silkflexindia.in; Website: www.silkflexindia.in

#### NOTICE OF 8TH (EIGHTH) AGM, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 8th Annual General Meeting (AGM) of the Members of the Company "Silkflex Polymers (India) Limited" ("Company" (CIN:L51909WB2016PLC215739) is scheduled to be held on Thursday, 26th day of September, 2024 at 04:00 PM IST through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM), to transact the businesses as set out in the Notice of AGM dated 30th August, 2024 pursuant to the MCA General Circular No. 10/2022 dated December 28, 2022 read with SEBI Circular Nos. SEBI/HO/CFD/PoD-2/P/ CIR/2023/4 dated January 05, 2023.

Notice of AGM and Annual Report for FY 2023-2024 is dispatched to all the eligible members whose e-mail address are registered with the Depository Participants (DPs) / Company / Registrar & Transfer Agent of Company through electronic mode only and the physical copy of the AGM Notice and Annual Report will not be sent separately to any shareholder. The same is alsoavailable on the website of the Company at www.silkflexindia.in.

The businesses as mentioned in the Notice of AGM may be transacted through e-voting facility to enable the eligible members to cast their votes electronically and accordingly company has engaged the services of National Securities Depository Limited (NSDL) to provide remote e-voting facility and e-voting facility during the AGM to the eligible members of the company. The Notice of AGM is published on the website of NDSL's at www.evoting.nsdl.com and on Company's website at www.silkflexindia.in.

The members can participate in the Annual General Meeting ONLY through VC/ OAVM facility. The details of which is provided by the company in the Notice of the Meeting. Accordingly, no provision had been made to enable the shareholders to attend and participate in the 8th AGM of the company in person. Members attending the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act, 2013. Pursuant to Section 91 of Companies Act, 2013 read with rules made there under

and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Book of the Company will remain closed from Friday, 20th day of September, 2024 to Thursday, the 26th day of September, 2024 (both days inclusive) for the purpose of 8th AGM.

The details required under Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standard issued by ICSI, are mentioned below . The Ordinary and Special Businesses as set out in the Notice of AGM may be transacted through voting by electronic means only, which is detailed in

! The cut-off date for determining the eligibility to vote by electronic means is Thursday, 19th day of September, 2024;

The remote e-voting of the Company shall commence on Monday. 23rd September, 2024 from 10.00 AM IST and end on Wednesday, 25th September, 2023 at 05.00 PM IST. The remote e-voting shall not be allowed beyond the aforesaid date and time. Once the votes are cast by the members the same cannot be changed by them;

4. A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the Depositories as on the cut-off date i.e. Thursday, 19th day of September, 2024, shall only be entitled to avail facility of remote e-voting or e-voting at the AGM; i. A person, who acquires the shares and becomes a shareholder of the

company after the dispatch of the Annual Report and holds shares as on the cut-off date i.e. Thursday, 19th day of September, 2024, may follow the procedure for obtaining User ID and Password as provided in the Notice of the Meeting which is available on the website of the company and on NSDL website. If the Shareholder is already registered with NSDL for e-voting then he/she can use his/her existing user ID and Password for casting the vote through remote e-voting;

The members who have cast their vote through remote E-Voting prior to the AGM may also attend the AGM through VC and OAVM but shall not be entitled to cast their vote again; The Company has appointed Ms. Insiya Nalawala, Practicing Compan

Secretary as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and Members are requested to note that pursuant to the MCA and SEBI circulars.

the company will not be sending physical copies of AGM Notice and Annual Report to the members of the company. In case of any queries/grievance with regard to e-voting, you may refer the

Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on.: 022-4886 7000 or send a request to Ms.Pallavi Mhatre, Senior Manager at evoting@nsdl.com. By order of the Board of Directors

For, Silkflex Polymers (India) Limited Nikita Jaiswal Place: Kolkata Company Secretary and Compliance Officer Date: 31/08/2024

### Choice International Ltd. Choice

Equity | Commodity | Currency | Wealth Management Investment Banking | Management Consulting CIN NO: L67190MH1993PLC071117

Registered Office: Sunil Patodia Tower, Plot No. 156-158, J.B. Nagar, Andheri (East) Mumbai-400 099 Tel No.: +91-22-6707 9999, Website: www.choiceindia.com Email ID: info@choiceindia.com/secretarial@choiceindia.com

# 31<sup>51</sup> ANNUAL GENERAL MEETING (AGM)

Notice is hereby given that 31" Annual General Meeting (AGM) of the Members of Choice International Limited will be held on Saturday, September 21, 2024 at 12.00 Noon (IST) at Sai Palace Hotel, Mahakali Caves Road, Chakala, Andheri (East), Mumbai, Maharashtra - 400093, to transact the business, as set forth in the Notice of the Meeting dated August 30, 2024.

In terms of Section 101 and 136 of the Companies Act, 2013 read together with the Rules, Regulation 36(1)(a) of LODR Regulations, the Copy of the Annual Report comprising of Financial Statements, Board's Report etc. and the Notice are being sent by electronic mode, to those members who have registered their email addresses with their respective depository participants or with the Registrar and Share Transfer Agents of the Company, unless any member has requested for a physical copy of the Annual Report, you may send your request to info@choiceindia.com /secretarial@choiceindia.com mentioning your Folio/ DP & Client ID. Those members, who desire to receive notice / financial statement / other documents through e-mail, are requested to communicate their e-mail ID and changes thereto, from time to time, to his / her Depository Participant (in case of Shares held in dematerialized form) / RTA in Form ISR 1 (in case of Shares held in physical form).

The Annual Report along with the Notice of AGM is available on the Company's Website www.choiceindia.com.

The Company will be providing its shareholders e-voting facility in compliance with the Companies Act, 2013, Rules and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Company has engaged CDSL as the authorized agency to provide e-voting facility. The details as required pursuant to the Act and Rules are as under:

- The cut-off date to determine eligibility to cast votes by electronic voting is Saturday, September 14, 2024. The e-voting shall be open for Three (3) days, commencing at 9:00 a.m. (IST) on Wednesday, September 18, 2024 and ending at 5:00 p.m. (IST) on Friday, September 20, 2024 for all shareholders, whether holding shares in physical form or in dematerialized form. The e-voting module shall be displayed by CDSL for voting thereafter.
- E-Voting shall not be allowed beyond the said date and time. The members who have not cast their votes by E-voting can exercise their voting rights at the AGM. The Company will make arrangement of Ballot Papers in this regards at the AGM Venue.
- Amember may participate in the meeting even after exercising his/her right to vote through e-voting, but shall not be allowed to vote again at the
- A person, whose name is recorded in the register of the members or in the register of beneficial owners maintained by the depositories as on cut-off date only shall be entitled to avail the facility of E-voting as well as voting at the meeting through ballot papers. A person, who acquires shares and becomes shareholder of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date can do e-voting by obtaining login-id and password by sending an e-mail to info@choiceindia.com/ secretarial@choiceindia.com by mentioning their Folio No. and Client ID. However, if such shareholder is already registered with CDSL for e-voting then existing user-id and password can be used for casting your vote.
- The Company has appointed M/s. R. M. Mimani & Associates LLP. Company Secretaries as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

For detailed instruction pertaining to e-voting, members may please refer to the section "Notes" in Notice of the Annual General Meeting, in case of queries o grievances pertaining to e-voting procedure, shareholders may write the evoting user manual for Shareholder available at helpdesk.evoting@cdslindia.com or may contact:

Particulars Control Departure Control (India) Limited Chalco International Limited

Paruculars	Central Depository Services (India) Limited	Choice International Limited
Address	Central Depository Services (India) Limited Marathon Futurex, A-Wing, 25th floor, NM Joshi Marg, Lower Parel, Mumbai – 400 013	Sunil Patodia Tower, Plot No. 156-158, J B Nagar Andheri (East), Mumbai – 400 099
Name & Designation	Rakesh Dalvi Deputy Manager	Ms. Karishma Shah Company Secretary & Compliance officer
Tel	Toll Free No. 1800 22 55 33	(022)6707 9999
		info@choiceindia.com/ secretarial@choiceindia.com

NOTICE IS FURTHER given pursuant to Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 91 of the Companies Act, 2013 (including Rules) that the Register of Members & Share Transfer Books will remain closed form Sunday, September 15, 2024 to Saturday, September 21, 2024 (both days inclusive) for the said AGM of the Company.

For Choice International Limited

Karishma Shah Place : Mumbai Date : August 30, 2024 (Company Secretary & Compliance officer)

# "IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner

## ELITECON INTERNATIONAL LIMITED

Regd. Off: 152, Shivani Apartments, Plot No. 63, I.P. Extention, Patparganj, Delhi -110092

CIN: L16000DL1987PLC396234, Email Id: admin@eliteconinternational.com CORRIGENDUM TO THE NOTICE OF THE EXTRAORDINARY GENERAL MEETING

An Extraordinary General Meeting ("EGM") of the Members of Elitecon International Limited ("the Company") is scheduled to be held on Monday, September 02, 2024 at 04.00 P.M., (IST) at the registered office of the Company at 152, Shivani Apartments, Plot No. 63, I.P. Extention, Patpargani, New Delhi -110092. The Notice of the EGM ("EGM Notice") was dispatched to the Shareholders of the Company on August 10, 2024 in due compliance with the provisions of the Companies Act, 2013, and rules made thereunder, read with circulars issued by Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. Capitalized words and expressions used but not defined herein shall have the same meaning as assigned to them in the EGM Notice.

This Corrigendum is being issued to give notice to amend/ provide additional details as mentioned herein and pursuant to the provisions of SEBI (Issue of Capital and Disclosure) Requirements) Regulations, 2018:

1. Paragraph (a) of Item No. 2 in the Explanatory Statement is modified to state the following

a) The chiecte of the preferential ice up are as under-

Sr. No.	Objects of the Issue	Total estimated amount to be utilised for each of the Objects* (In Rs. Lakhs)	Tentative timelines for utilization of Issue Proceeds from the date of receipt of funds	
1.	Repayment of unsecured loan received from the Promoter & Promoter Group of the Company	6,800	Within 12 months from receipt of funds for the	
2.	Acquisition of M/s Golden Cryo 1,050 Private Limited		Warrants (as set out herein)	
3.	General Corporate Purposes	8,000	1 116	

Company within 18 (eighteen) months from the date of allotment of the Warrants in terms of Chapter V of the SEBI ICDR Regulations, and as estimated by our management, the entire Issue Proceeds would be utilized for all the aforementioned Objects, in phases, as per the Company's business requirements and availability of Issue Proceeds, within 12 months from the date of receipt of funds for the Warrants (as set out herein). In the event there is any shortfall in receipt of funds, the Board of Directors of the Company will have absolute discretion in reallocating the funds to be deployed against each object as mentioned above. In terms of the BSE Circular No. 20221213-47 dated December 13, 2022, the amount specified for the aforementioned Objects may deviate +/- 10% depending upon the future circumstances, given that the Objects are based on management estimates and other commercial and technical factors. Accordingly, the same is dependent on a variety of factors such as financial, market and sectoral conditions, business performance and strategy, competition and other external factors, which may not be within the control of the Company

\*considering 100% conversion of Warrants into equity shares within the stipulated time.

The Preferential Issue is for convertible Warrants, the Issue Proceeds shall be received by the

If the Issue Proceeds are not utilised (in full or in part) for the Objects during the period stated above due to any such factors, the remaining Issue Proceeds shall be utilised in subsequent periods in such manner as may be determined by the Board, in accordance with applicable laws. This may entail rescheduling and revising the planned expenditure and funding requirements and increasing or decreasing the expenditure for a particular purpose from the planned expenditure as may be determined by the Board, subject to compliance with applicable laws.

and may result in modifications to the proposed schedule for utilization of the Issue Proceeds

at the discretion of the Board, subject to compliance with applicable laws.

### Monitoring of Utilization of funds:

As the issue size exceeds Rs. 100 Crore (Rupees One Hundred Crore), in terms of Regulation 162A of the SEBI ICDR Regulations, the Company has appointed Acuite Ratings & Research Limited, a SEBI registered Credit Rating Agency as the monitoring agency to monitor the use of the proceeds of the Preferential Issue ("Monitoring Agency").

The Monitoring Agency shall submit its report to the Company in the format specified in Schedule XI of the SEBI ICDR Regulations on a quarterly basis, till 100% (One Hundred Percent) of the Issue Proceeds have been utilized. The Board and the management of the Company shall provide their comments on the findings of the Monitoring Agency in the format as specified in Schedule XI of the SEBI ICDR Regulations. The Company shall, within 45 (forty five) days from the end of each quarter, upload the report of the Monitoring Agency on its website and also submit the same to the Stock Exchanges.

By Order of the Board of Directors For Elitecon International Limited (VIPIN SHARMA) Managing Director DIN: 01739519

Date : August 30, 2024 venis

**Venus Pipes & Tubes Limited** (Formerly Known as Venus Pipes & Tubes Private Limited) (CIN: L74140GJ2015PLC082306)

Regd. Office: Survey No. 233/2 and 234/1 Dhaneti BHUJ Kachchh GJ 370020 IN | Phone No.: +91 2836 232 183/84 Email: cs@venuspipes.com | Website: www.venuspipes.com

NOTICE OF 10th ANNUAL GENERAL MEETING INFORMATION ON REMOTE E-VOTING AND OTHER INFORMATION

NOTICE is hereby given that the 10" Annual General Meeting (AGM) of the members of Venus Pipes & Tubes Limited (the Company) will be held through Video Conference (VC). or Other Audio Video Means (OAVM) on Wednesday, September 25, 2024 at 04:00 PM (IST), pursuant to and in compliance with general circular nos. No. 09/2023 dated September 25, 2023, issued by Ministry by Corporate Affairs and SEBI Circular no. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 7, 2023 issued by SEBI (hereinafter referred to as the Circulars) and all other applicable laws to transact the business that will be set forth in the

In compliance with the aforesaid circulars, the Annual Report of the Company for the financial year 2023-24 along with the notice of AGM and other reports/documents (AGM documents) were sent to the members on Friday, August 30, 2024 in electronic mode only, to those shareholders whose e-mail addresses are registered with the RTA or Company or made available to the Depositories. The AGM documents are available on Company's website www.venuspipes.com and also on the websites of the stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively. Members are requested to note that physical/hard copies of the Annual

Report will not be sent by the Company. Pursuant to Section 108 of the Companies Act, 2013 (the Act) read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2015 and Regulations 42 and 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI LODR, 2015), the Company is pleased to provide e-voting facility to members to cast their vote on all the resolutions set forth in the notice convening the 10" AGM. The members may cast their vote electronically through electronic voting system (remote e-voting) of Kfin Technologies

Limited (Kfintech)

All members are further informed that: The ordinary and special business as set out in the Notice of AGM may be transacted

through voting by remote e-voting or e-voting system during the AGM. The remote e-voting period shall commence on Saturday, September 21, 2024 (09:00) AM IST) and ends on Tuesday, September 24, 2024 (5:00 PM IST). The remote e-voting shall be disabled by Kfintech thereafter. Once the vote on a resolution is cast by the Member, he / she / it shall not be allowed to change it subsequently. The cut-off date (Record date) for determining the eligibility of members to vote by remote

It is further informed that the board of directors of the Company have recommended a Final dividend of ₹ 0.50/- per equity share (5%) on par value of ₹ 10/- per share for the financial year ended March 31, 2024 to those members as on record/cut-off date i.e. September 18, 2024 subject to the approval of members at the ensuing Annual General Meeting of the company. The dividend will be paid within 30 days from the date of AGM

e-voting or at the AGM is Wednesday, September 18, 2024.

after the despatch of the notice of the 10" AGM and holds shares as of the cut-off date i.e. Wednesday, September 18, 2024, may obtain the User ID and password in the manner If the mobile number of the Member is registered against Folio No./DP ID and Client ID, the Member may send SMS: MYEPWD <space> E-Voting Event Number + Folio No. or DP ID and Client ID to No. 9212993399 Example for NSDL: MYEPWD <SPACE>

Any person who acquires shares of the Company and becomes member of the Company

IN12345612345678 Example for CDSL: MYEPWD <SPACE> 1402345612345678 Example for Physical: MYEPWD <SPACE> XXXX1234567890. If e-mail address or mobile number of the Member is registered against Folio No./DP ID and Client ID, then on the home page of https://evoting.kfintech.com, Member may click "Forgot Password" & enter Folio No. or DP ID & Client ID & PAN to generate a new password.

You may also send an e-mail request to einward.ris@kfintech.com, The facility of e-voting shall also be made available during the AGM on Wednesday, September 25, 2024. Those members present at the AGM through VC/QAVM, who have not cast their vote by remote e-voting and are otherwise not debarred from doing so, shall be eligible to vote through the e-voting system during the AGM on Wednesday, September 25, 2024 and the members who have cast their vote by remote e-voting prior

to the AGM, may attend the AGM but will not be entitled to cast their vote again; and The instructions for remote e-voting, e-voting during the AGM, participation in the AGM through VC/OAVM and manner in which the user id and passwords can be obtained by members whose email address are not registered with Company/Depository to enable them cast their vote and register their email address are provided in the Notice of AGM. The Notice of AGM documents is available on Company's website www.venuspipes.com and on the websites of the stock exchanges i.e. BSE Limited and The National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and

also on the website of Kfintech viz. https://www.kfintech.com. The Company has appointed Mr. Piyush Babubhai Prajapati (Membership No. FCS) 12711 and CP No. 18332) from M/s Pivush Prajapati & Associates, Practicing Company Secretaries as a Scrutinizer as to scrutinize the remote e-voting prior to the AGM and e-voting process during the AGM in a fair and transparent manner

Queries/ grievances Refer to the FAQs for Members and e-voting user manual available relating to e-voting at the download section of https://www.evoting.kfintech.com or call on tollfree no.: 1800-309-4001. Registrar and Share Kfin Technologies Limited, Unit: Venus Pipes and Tubes Limited, Transfer Agent Selenium, Tower B, Plot No. - 31 and 32, Financial District,

Nanakramguda, Serilingampally, Hyderabad (T.G.) - 500 032 Email ID: einward.ris@kfintech.com, Website: www.kfintech.com Company Write a mail to at cs@venuspipes.com Manner of receiving AGM documents or user id and password for members whose

Members who have not registered their email address are requested to send a request to the

Registrar and Transfer Agents of the Company, Kfin Technologies Limited at email: einward.ris@kfintech.com or to the Company at cs@venuspipes.com providing the following details to obtain the AGM documents or user-id and password for remote e-voting or for attending the AGM through VC/OAVM. Members holding Folio No., Name of shareholder, scanned copy of the share certificate

email address are not registered with the Company/Depository are as follows:

in physical mode (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) Members holding DP ID and Client ID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name of shareholder, client master or copy of Consolidated Account

> (self-attested scanned copy of Aadhar Card) For, Venus Pipes & Tubes Limited

> > Pavan Kumar Jain

Company Secretary (Membership No.: A66752)

Ahmedabad

financialexp.epapr.in

By Order of the Board of Directors

Date: 30.08.2024

Place: Dhaneti

statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR